

નોન ઈકેવાયસી: ગ્રાહક સુધારા ફોર્મ (કસ્ટમર એડેન્ડમ ફોર્મ)

(દેવ દ્વારા નોન-કેવાયસી થકી ખાતુ ખોલાવનાર ગ્રાહકો દ્વારા ભરવાપાત્ર)

તારીખ	D D M M Y Y Y Y	ખાતા નં.		એઓએફ આઈડી	
ગ્રાહક વિગતો					
*નામ					
ગ્રાહક આઈડી				*મોબાઇલ નં. +91	
બીજા અરજદાર					
*નામ					
ગ્રાહક આઈડી				*મોબાઇલ નં. +91	
				પ્રથમ અરજદારનો ફોટો	બીજા અરજદારનો ફોટો
નામ :				નામ :	

મારા/અમારા દ્વારા એયુ સ્મોલ ફાયનાન્સ બેંક લિ.(એયુએસએફબી/બેંક) સાથે સેવિંસ/કરન્ટ ખાતું ખોલવવા માટેની અરજી કરવામાં આવી છે જે શાખા ધરાવે છે. આ અરજીના વધુ પ્રોસેસિંગ માટે નીચે દર્શાવ્યા અનુસાર જરૂરી દસ્તાવેજો મારા/અમારા દ્વારા જમા કરાવવામાં આવ્યા છે.

કેવાયસી દસ્તાવેજ	ઓળખનો પુરાવો		સરનામાનો પુરાવો	
	દસ્તાવેજનું નામ	આઈડી નંબર	દસ્તાવેજનું નામ	આઈડી નંબર
પ્રથમ અરજદાર				
બીજા અરજદાર				

નિયમો, શરતો અને ઘોષણાઓ – ટેબ ખાતું ખોલવા માટે

આથી મારા/અમારા દ્વારા એઓફકુ કરવામાં આવે છે, જે એયુએસએફબીના કર્મચારી આઈડી દ્વારા તમામ સંબંધમાં સાચા, ચોક્કસ, સંપૂર્ણ અને અદ્યતન હોવાની યોષણ કરીએ છીએ અને એપ્રોવેકેશનની વિગતોના મારા/અમારા મૂલ્યાંકન, ખરાઈ અને મંજૂરી બાદ ઇલેક્ટ્રોનિક એપ્રોવેકેશન ફોર્મમાં સંદર્ભમાં ઉપરોક્ત જણાવેલ એઓએફ આઈડી નંબર એયુએસએફબી દ્વારા ફાલતવામાં આવ્યો છે. ઉપર જણાવેલ સેવિંગાકરન્ટ બેંક ખાતા માટે ઇલેક્ટ્રોનિક એપ્રોવેકેશન ફોર્મ અને ડિજીટલ કન્ફર્મેશન ફોર્મ સાથે ધબીને ખાતું ખોલવા માટેનો દસ્તાવેજની રચના કરશે. મારા/અમારા દ્વારા યોગ્ય ધોષિત કરવામાં આવે છે કે ઇલેક્ટ્રોનિક એપ્રોવેકેશનમાં અપેક્ષે કોરોગ્રાફ, સહી, વિગતો અને ઘોષણા સાચા છે અને મારી/અમારી શ્રેષ્ઠ જાણમાં અદ્યતન છે અને મારા/અમારા દ્વારા એયુએસએફબીને ખાતું ખોલવા માટે અને ત્યાર બાદની બેંકિંગ લેવડદેવટ માટે મારી/અમારી ઇલેક્ટ્રોનિક એપ્રોવેકેશન/વિગતોનો ઉપયોગ કરવાની અધિકૃતતા આપવામાં આવે છે. આ એપ્રોવેકેશન ફોર્મમાં આપવામાં આવેલ તમામ વિગતો અને જાણકારી (તમે તેની સાથે જણાવેલ અથવા સાથે પૂરા પાડેલ તમામ દસ્તાવેજ અરજદારના ટેક્સપેયર આઈડેન્ટીફીકેશન નંબર સહિત તમામ સંબંધમાં સાચા, ચોક્કસ, સંપૂર્ણ અને અદ્યતન છે અને મારા/અમારા દ્વારા કોઈ જાણકારી તેડી રાખવામાં આવી નથી. હું/અમે સમજૂ છું/સમજીએ છીએ કે મારા/અમારા દ્વારા આપવામાં આવેલ કટલીફ વિગતો બેંકિંગ કંપનીઓનું સંચાલન કરતી કાર્યકારી માર્ગદેશિકાઓને જરૂરી છે. મારા/અમારા દ્વારા તમામ સમયે, મારા/અમારા કોમ્યુનિકેશન સરનામામાં કોઈપણ બદલાવ/ફેરફાર વિશે એયુએસએફબીને માહિતગાર રાખવામાં બાંધધરી આપવામાં આવે છે અને મારા દ્વારા લેખિતમાં એયુએસએફબીને જાણ કરવામાં આવી શ્રેય અને/અથવા મારા દ્વારા એયુએસએફબીના પટ્ટામાં લાવવામાં આવ્યો હોય તેવી મારા/અમારા કોમ્યુનિકેશન સરનામામાં થયેલ કોઈપણ બદલાવ/ફેરફારને અપડેટ કરવાની એયુએસએફબીને અધિકૃતતા આપવામાં આવે છે અને આ સાથે આવા બદલાયેલ સરનામા પર મારી/અમારા સંપર્ક કરવાની એયુએસએફબીને અધિકૃતતા આપવામાં આવે છે. મારા/અમારા દ્વારા એયુએસએફબીને સમયે સમયે જરૂરી હોય તેવી કોઈપણ વધુ જાણકારીઅપડેટ કરેલ કેવાયસી દસ્તાવેજ પૂરા પાડવાની બાંધધરી આપવામાં આવે છે. મારા/અમારા દ્વારા કોઈપણ બોડી જાણકારી પૂરી પાડવાના કારણે અથવા વિગતોજાણકારીમાં કોઈ બદલાવ વિશે જાણ કરવામાં નિષ્ફળતાને કારણે એયુએસએફબીને થયેલ કોઈપણ ઉત્તરપિડી, ખોટ અથવા નુકસાન સામે એયુએસએફબીને ઈન્ડેમ્નીફાય કરવાની મારા/અમારા દ્વારા મંજૂરી આપવામાં આવે છે. કોઈપણ કાસ્ટ આવા વગર એયુએસએફબી કોઈપણ અરજીનામંજૂર કરવાનો અધિકાર ધરાવે છે. આ સાથે પૂરા પાડવામાં આવેલ કોરોગ્રાફ્સ સહિતના એપ્રોવેકેશન ફોર્મ અને દસ્તાવેજ જાળવવાનો એયુએસએફબી અધિકાર ધરાવે છે અને નામંજૂરીના કિસ્સામાં મને/અમને તે પરત કરવામાં આવશે નહીં. હું/અમે સમજૂ છું/સમજીએ છીએ કે, બેંક લાગુ થતી નિયમકાયા / વેધાનિક / આંતરિક માર્ગદેશિકાને આધિન તેની સંપૂર્ણ મુનસફી મુજબ કોઇપણ સમયે અને સમયોત્તરે આ નિયમો અને શરતોમાં ઉમેરો કરી શકે છે, તેને બદલી શકે છે કે તેમાંથી કોઇમાં પણ ફેરફાર કરી શકે છે અને હું/અમે આવા તમામ ફેરફારોનું પાલન કરવા અને તેની સાથે બાધ્ય થવા માટે સંમત થાઉં છું/છઇએ છીએ, કાસ્ટ છે કે નિયમો અને શરતોના કિસ્સાની રચના કરે છે તથા આ પ્રકારના કોઇપણ ફેરફાર બાદ બેંકમાં રહેલા મારા/અમારા ખાતા(ઓ)માં થયેલી કોઇપણ લેવડદેવટ અને/અથવા મારા/અમારા દ્વારા કોઇપણ સેવાનો ઉપયોગ એ આ પ્રકારના તમામ ફેરફારોને મારી/અમારી સ્વીકૃતિ છે તેમ માનવામાં આવશે અને મારી/અમારી સ્વીકૃતિને સમાન ગણવામાં આવશે. નવીકૃતિને સમાન ગણવામાં આવશે. મને કમલે કમ ૩૦ ઈસવીની નોટિસ આપીને બેંક કોઈપણ સમયે મારું ખાતું બંધ કરવાની સ્વતંત્રતા ધરાવે છે. જોકે, ખાતાઓમાં અગત્ય વ્યવહારો થવાના કિસ્સામાં, જેમ કે, આવશ્યક બેલેન્સ ન જાળવવું કે ખૂબ વધારે સંખ્યામાં ચેક રીટર્ન થવા વગેરે, બેંક ગોચર નોટીસ પાઠવ્યાં વગર જ મારા ખાતાને બંધ કરી દેવાનો અધિકાર ધરાવે છે. બેંક દ્વારા બંધ કરવામાં આવી રહેલા ખાતામાં બાકી બચેલી/બેલેન્સની રકમને લાગુ થતી ચાર્જિસ/બાકી નાણાંની વસતીલ કરતી લીધાં બાદ પ્રારંભિક ચૂકવણી જે ખાતામાંથી કરવામાં આવી હતી, તે ખાતામાં તેને પરત કરી દેવામાં આવશે. હું/અમે સમજૂ છું/સમજીએ છીએ અને મારી સંમતિ આપું છું/છઇએ છીએ કે, આ ખાતું ખોલવાની વિનંતી પ્રોસેસ કરતી વખતે જો મારા/અમારા દ્વારા આપવામાં આવેલ જાણકારીને આધારે બેંકને અનેક કસ્ટમર આઈડીની હજારી ઓળખાય તો, મારા તમામ સક્રિય સંબંધ(સંબંધો) મારી/અમારી યોગ્ય જાણકારી અંતર્ગત બેંક રેકૉર્ડમાં અદ્યતન/સૌથી જમા કરતમ આઈડી સાથે સંબંધમાં/સમાવર્તીત કરવામાં આવી શકે છે. એકવાર મેં થયા પૂર્ત મુત ગણ(ઉપાયોગિક સમાપ્ત) માટે ટર્મ ડિપોઝીટ બેંક દ્વારા રીન્યુ કરવામાં આવશે નહીં. કેવાયસીના સંદર્ભમાં અથવા અન્ય કોઈ વિગતોના સંદર્ભમાં બેંક દ્વારા સમયે સમયે જરૂરી/માંગવામાં આવી શકે તેવી કોઈ અનિશ્ચિત જાણકારી પૂરી પાડવા હું/અમે આ સાથે સમજૂ છું/સમજીએ છીએ અને મંજૂર કરું છું/કરીએ છીએ. મારા/અમારા દ્વારા ધોષિત કરવામાં આવે છે કે ઉપરોક્ત ફોર્મમાં પૂરી પાડવામાં આવેલ તમામ જાણકારી સાચી છે અને પૂરા પાડવામાં આવેલ દસ્તાવેજો અથવા કેવાયસી વિગતો સહિત ઉપરોક્ત જાણકારીમાં ત્યારબાદના કોઈપણ બદલાવ વિશે આવા બદલાવના ૩૦ ઈવસની અંદર બેંકને જાણ કરવાની મારા/અમારા દ્વારા બાંધધરી આપવામાં આવે છે. મેં/અમે www.aubank.in પર દર્શાવવામાં આવેલ એયુ ક્યુઅર ડોડના નિયમો અને શરતોની તમામ જોવાવાઇઓને વાંચી અને સમજી લીધી છે તથા હું/અમે તેનું પાલન કરવા અને તેની સાથે બાધ્ય થવા માટે સંમત થાઉં છું/છઇએ છીએ. એડિન્ગની લોકલિંગ વિનિયમો

હું/અમે એ સમજૂ છું/સમજીએ છીએ કે, બેંક લિ.માં ખોલાવવામાં આવેલા મારા/અમારા ખાતા(ઓ)ના વ્યાયમથી સંચાલિત થતી તમામ સંપત્તિઓના લાભારથી માલિક છું/છીએ. આ ખાતાઓ મારફતે સંચાલિત થતી કેટલીક/તમામ સંપત્તિઓના લાભારથી માલિકો છે જેમના માટે ખાતું જાળવવામાં આવ્યું છે, તે વ્યક્તિનું નામ અને સંપત્તિનું નામ અને સંપત્તિનું નામ અને સંપત્તિનું નામ આપવામાં આવ્યું મુજબની સમમ કોટે બેંક વિરુદ્ધ કરવામાં આવતાં કોઇપણ દાવાઓના સંબંધમાં વિશિષ્ટ અધિકારસેતર ધરાવશે. જોકે, તેનાથી બેંકની સાથાઓ આ રહેલા મારા/અમારા તમામ ખાતાઓ પરનો બેંકની સર્વસામાન્ય ધારણાધિકાર અને સેટ-ઓફનો અધિકાર પ્રભાવિત થશે નહીં તથા આ હેતુ માટે બેંક આ પ્રકારના તમામ કે કોઇપણ ખાતાઓને ભેગા કરી દેવા અને એકીકૃત કરવા માટે હકદાર છે.

હું/અમે એ બાંધધરી આપું છું/આપીએ છીએ કે, બેંક લાગુ થતી નિયમકાયા માર્ગદેશિકાઓનું પાલન કરીને સમયોત્તરે મારી/અમારી તાજેતરની માહિતી માંગી શકે છે અને કેવાયસીના જરૂરી દસ્તાવેજોને એકઠાં કરી શકે છે. ખાતું ખોલાવતી વખતે પૂરી પાડવામાં આવેલી મારી/સંબંધિત પાર્ટીની/લાભારથી માલિકની વિગતોમાં કોઇપણ ફેરફાર થવાના કિસ્સામાં હું/અમે બેંકને આ અંગે જાણ કરીશું/કરીશું, જે વિગતોમાં સરનામામાં ફેરફાર, ઇન્કર્પોરેશ ફેરફાર, રોજગારીમાં ફેરફાર વગેરેનો સમાવેશ થાય છે.

આધાર આ સાથે મારા/અમારા દ્વારા એયુ સ્મોલ ફાયનાન્સ બેંકને યુઆઈડીએઆઈ સાથે અધિકૃતતા માટે મારો આધાર નંબર, નામ અને આંગળીઓની/આંખનીડીકીની છાપ લેવા માટે મંજૂરી આપવામાં આવે છે. બેંક મને જણાવ્યું છે કે, મારી ઓળખની વિગતોનો ઉપયોગ કન્ન કેવાયસી માટે થશે અને મને એ પણ જણાવવામાં આવ્યું છે કે, મારા બાયોમેટ્રિક્સને સંજોગિત કરવામાં આવશે નહીં/જેર કરવામાં આવશે નહીં તથા તેને અધિકૃતતાના હેતુ માટે જ સીસાઈડીઆરને સોંપવામાં આવશે. હું/અમે અહીં ઉપર કરવામાં આવેલી ઘોષણાના સંદર્ભમાં આ પ્રકારની લેવડદેવડો બેંકની માહિતી/દસ્તાવેજો પૂર્ણ પાડવા માટે તથા તમને ગોચર રીતે સંતુષ્ટ કરવા માટે પણ સંમત થાઉં છું/છઇએ છીએ અને બાંધધરી આપું છું/આપીએ છીએ. વધારાની ઘોષણાઓ

હું/અમે એ સમજૂ છું/સમજીએ છીએ કે, બેંક દ્વારા સમયોત્તરે નિર્ધારિત કરવામાં આવ્યાં મુજબ મારા વચ્ચત / ચાલુ ખાતા માટે નિર્ધારિત કરવામાં આવેલું સરેરાશ માસિક બેલેન્સ (એવેરેમબી) જાળવવું અનિવાર્ય છે. જો લાગુ થતું હોય તો, બેંક તેની મુનસફી મુજબ સંબંધિત ખાતાના પોઝેજમાં ફેરફાર કરી શકે છે અને બેંક એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકની વેબસાઇટ www.aubank.in પર ઉલ્લેખિત અથવા તો બેંકની કોઇપણ શાખા ખાતે ઉપલબ્ધ ચાર્જિસના સમાપ્તપત્રમાં લાગુપાત્ર ફેરફાર લાગુ કરતાં પહેલાં ૩૦ ઈવસની નોટીસ પાઠવશે. હું/અમે જાહેર કરું છું/કરીએ છીએ કે, ઉપરોક્ત ફોર્મમાં પૂર્ણ પાડવામાં આવેલી તમામ વિગતો સાચી છે અને હું/અમે હવે પછીથી તેમાં કોઇપણ ફેરફાર થાય તો તેના અંગે તાત્કાલિક બેંકને જાણ કરવાની બાંધધરી આપું છું/આપીએ છીએ. હું/અમે આથી અહીં જાહેર કરું છું/કરીએ છીએ કે, અહીં ઉપર પૂરી પાડવામાં આવેલી વિગતો મારી/અમારી શ્રેષ્ઠ જાણકારી અને વિશ્વાસ મુજબ સાચી અને ખરી છે તથા હું/અમે તેમાં કોઇપણ ફેરફાર થાય તો તેના અંગે તાત્કાલિક તમને જાણ કરવાની બાંધધરી આપું છું/આપીએ છીએ. ઉપરોક્ત માહિતી જુજી કે ખોટી કે ગેરમાર્ગે દોરારી કે ખોટી રજૂઆત કરતી હોવાનું જાણવા મળ્યું તો, હું/અમે એ બાવતે વાહક છું/છીએ કે, મને/અમને તેના માટે જવાબદાર કેવવવામાં આવી શકે છે. હું/અમે અહીં ઉપર જણાવેલા નોંધણી પામલા નંબર/ઈ-મેઇલ એડ્રેસ પર એસએમએસ/ઈ-મેઇલ મારફતે સેન્ટ્રલ કેવાયસી સર્વિસીટી તરફથી માહિતી પ્રાપ્ત કરવાની સંમતિ આપું છું/આપીએ છીએ. હું/અમે આ ઉપરાંત એ વાતની પણ પુષ્ટી કરું છું/કરીએ છીએ કે, જ્યાં સુધી અન્ય કોઈ રીતે પુષ્ટી કરવામાં ન આવે ત્યાં સુધી સંદેશાવ્યવહારની મારી પસંદગીની ભાષા અંગ્રેજી જ રહેશે.

આ ઉપરાંત, હું/અમે સંદેશાવ્યવહારના નોંધણી પામેલા મોડેસ પર એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક લિ. તરફથી ઉત્પાદનો, સેવાઓ અને બેંક સંબંધિત અન્ય માહિતી મેળવવા માટે પણ સંમતિ આપું છું/આપીએ છીએ. નોન-કેવેલેબલ ક્રેડિટ ડિપોઝિટને તેની મેચ્યોરિટી અવધિ પહેલાં બંધ કરી શકાતી નથી. કન્ન મુલ્યાંકના કિસ્સામાં જ લાગુપાત્ર વ્યાજના વાજ વા વર્ષીય ટેક્સ સેવર ક્રિફ્ટ ડિપોઝીટનું પ્રિમેયોર રિલવીડેશન માન્ય છે. મારા/અમારા દ્વારા મને/અમારા વચ્ચે છે કે કોઇપણ નોન-કેવેલેબલ/ટેક્સ સેવર ડીટી ઓટો રીન્યુઅલ મોડમાં બુક કરવામાં આવશે નહીં પરંતુ આવી ડીટી પર ઍક્ટિવ ધારણાધિકારના કિસ્સામાં, પ્રિમેયોર વિશ્લેષકઅલ સુવિધા સાથે તેને રીન્યુ કરવામાં આવશે. મારા/અમારા દ્વારા લેખિત કરવામાં આવે છે કે ઉપરોક્ત ફોર્મમાં આપવામાં આવેલ તમામ વિગતો સાચી છે અને પૂરા પાડવામાં આવેલ દસ્તાવેજો અને કેવાયસી વિગતો સહિત ઉપરોક્ત જાણકારીમાં વ્યાવાહરના કોઈપણ ફેરફાર વિશે, આવા ફેરફાર થવાના ૩૦ ઈવસની અંદર બેંકને જાણ કરવાની બાંધધરી મારા/અમારા દ્વારા આપવામાં આવે છે. સગીરમથી પુખ્ત થવાના કિસ્સામાં જ્યાં પુખ્ત વ્યક્તિનું માન્ય થાન કન્ટ જમા ન કરાવામાં આવ્યું હોય તો – લાગુપાત્ર ટીબીએસ યાદા રહે લાગુ કરવામાં આવશે.

આ ખાતા સાથે ઉપલબ્ધ સુવિધાઓ/લાભારીકતાઓ સાથે ખાતું ખોલાવવા માટે અને ચલાવવા માટેના નિયમો અને શરતો મને/અમને સમજાવવામાં આવ્યા છે. પગાર ખાતાઓ માટે પગાર ખાતાઓ નિયોજીતા દ્વારા કરવામાં આવેલ કોઇપણ ડિપોઝિટને પહોંતાવવાની સૂચના નિયોજીતા દ્વારા એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકને આપવાની ધટનાના, આવી ડિપોઝિટની તારીખથી ત્રણ(૩) ઈવસની અંદર, એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક દ્વારા આવી સૂચનાની અમલ કરવામાં આવશે અને ગ્રાહકના ખાતામાં આવા કોઇપણ ડેબિટ માટે ગ્રાહક બેંક સાથે વિવાદ કરશે નહીં કે એવને જવાબદાર કેરવવામાં આવશે. આ હેતુ માટે છેલ્લે જે બેલક/સંગઠન તરફથી પગાર જમા કરવામાં આવ્યો હશે, તેને નિયોજીતા ગણવામાં આવશે. જોકે, એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકને નિયોજીતાની ઉપર મુજબની સૂચના પર અમલ કરવા બદલ કોઇપણ પ્રકારે જવાબદાર ટેવની શકાશે નહીં. જો સતત ૩ મહિના માટે પગાર ખાતામાં પગાર જમા થતો નથી, તો આવી ધટનામાં બેંક ખાતાધારક / મને કોઇપણ પ્રકારની જાણ કર્યા વગર પગાર ખાતાના સ્ટેટમેન્ટ સેવિંગ્સ વેલ્યુ એકાઉન્ટમાં ફેરવી નાંખવાનો અધિકાર ધરાવે છે તથા તેનું સ્ટેટમેં બદલાવાની તારીખથી જ બચત ખાતાને લાગુ થતાં નિયમો અને શરતો આ ખાતાને લાગુ થવાના ચાલુ થઈ જશે.

તારીખ	સીકેવાયસીઆર નં.	પ્રથમ અરજદાર		
સ્થળ	સીકેવાયસીઆર નં.	બીજા અરજદાર	પ્રથમ અરજદારની સહી	બીજા અરજદારની સહી

કસ્ટમર સિએયર કાફ (ફક્ત ગ્રાહક દ્વારા ભરવાપાત્ર)

મારા/અમારા નામ	પ્રથમ અરજદાર	નામ	બીજા અરજદાર
દ્વારા એયુ સ્મોલ ફાયનાન્સ બેંકને મારા/અમારા કસ્ટમર આઈડી સાથે નીચેની સહી તેમના રેકૉર્ડમાં અપડેટ કરવાની વિનંતી કરવામાં આવે છે.			
તારીખ	D D M M Y Y Y Y		
ગ્રાહક આઈડી	પ્રથમ અરજદાર	ગ્રાહક આઈડી	બીજા અરજદાર
નામ :		નામ :	

બેંકના ઉપયોગ માટેનો વિગતો

મે શ્રી/કુમારી _____ અને _____ ની વ્યક્તિગત રીતે તેમના/તેણીના ઘર/ઓફિસ/બેંકની શાખા ખાતે મુલાકાત લીધી છે અને મંજૂર કરું છું કે અરજદાર દ્વારા રજૂ કર્યા અનુસાર ઓળખ અને સરનાનામાં વાસ્તવિક દસ્તાવેજોની(લાગુ પડ્યા અનુસાર) ખરાઈ કરી છે અને તેને કેપ્ચર કર્યાં છે. હું એ પણ મંજૂર કરું છું કે ફોર્મ અને અન્ય એનેક્સર પર મારી હાજરીમાં અરજદાર દ્વારા સહી કરવામાં આવી છે.

શાખા અધિકારીનું નામ: _____

શાખા અધિકારી કર્મચારી કોડ: _____ શાખા કોડ : _____ (ફક્ત ઓફિસના ઉપયોગ માટે) _____

ખાતું ખોલવા માટે કોઈ ચાર્જિસ વસૂલવામાં આવતાં નથી. એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક લિ. (સ્વીકૃતિ / ગ્રાહકની નકલ) ફોર્મ નં. _____ અમારી સાથે બેંકિંગ કરવા બદલ અમે આપનો આભાર માનીએ છીએ અને તમારા તરફથી ખાતું ખોલવા માટેનું ફોર્મ પ્રાપ્ત થયું હોવાની સ્વીકૃતિ આપીએ છીએ.

તમારા એટીએમ/ડેબિટ કાર્ડ માટે પિન જનરેટ કરવા માટેના સૂચનો, એટીએમ પર લેવડદેવટ હાથ ધરવા માટેના સૂચનો ડેબિટ કાર્ડના સ્વાગતતપત્રમાં જણાવવામાં આવેલા હશે. પિન નંબરની ગોપનીયતા જાળવવા વિનંતી અને પિન નંબરના કુટૂપયોગ માટે બેંકને જવાબદાર કેરવવામાં આવશે નહીં.

- હું/અમે સમજૂ છું/સમજીએ છીએ કે, પાસવર્ડ માટે નોંધણી પામેલા ગ્રાહકો માટે ખાતાનું ડ્રોનિક્કસ સ્ટેટમેન્ટ પ્રાપ્ત કરવાની સુવિધાને બંધ કરી દેવામાં આવશે.

- હું/અમે સમજૂ છું/છીએ કે, ખાતાના ડ્રોનિક્કસ સ્ટેટમેન્ટને પસંદ કરવામાં આવ્યું હોવા છતાં નોંધણી પામેલા ઈ-મેઇલ આઈડી/મોબાઇલ જે પણ વાતુ થતું હોય તેની પર માસિક/વાર્ષિક ધોરણે ડીહોલ્ટ રીતે આપમેળે ખાતાનું ડિજિટલ સ્ટેટમેન્ટ પણ મોકલી આપવામાં આવશે.

- મેં/અમે www.aubank.in પર દર્શાવવામાં આવેલા એયુ ક્યુઅર કોડના નિયમો અને શરતોની તમામ જોવાવાઇઓને વાંચી અને સમજી લીધી છે તથા હું/અમે નું પાલન કરવા અને તેની સાથે બાધ્ય થવા માટે સંમત થાઉં છું/છઇએ છીએ.

ગ્રાહકનું નામ _____ એચુ સ્મોલ ફાઇનાન્સ બેંક લિ. (સ્વીકૃતિ / ગ્રાહકની નકલ) _____ દ્વારા _____
રોકડ/ચેક નં./એનઈએફટી/આરટીજીએસ/ઈન્ટર્નલ ટ્રાન્સફર/ઓનલાઈન ટ્રાન્સફર
ની તરફેણમાં કરેલ રકમ રૂ. _____ આવશ્યક લઘુત્તમ સરેરાશ બેલેન્સ (માસિક) _____ (યાજની વિગતો માટે કૃપા કરીને લાગુ થતાં ચાર્જીનું સમયપત્રક જુઓ)
વેરિયેન્ટનું નામ _____ બેંકના અધિકારીનું નામ _____
તારીખ _____ નોમિનેશન પ્રાપ્ત થયું: ☐ હા ☐ ના બેંકના અધિકારીની સહી (બેંકની મહોરની સાથે) _____